

કીટકશાસ્ત્ર વિભાગ, બીએસીએ દ્વારા કપાસના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંગે
ખેડૂત દિનની ઉજવણી તા: ૨૦/૦૧/૨૦૧૮ ના રોજ કરવામાં આવી

આણંદ કૃષિ યુનિવર્સિટીની બં. અ. કૃષિ મહાવિદ્યાલયનાં કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા કપાસ ઉગાડતા ખેડૂતો માટે આ પાકમાં આવતી જીવાતોની સમસ્યાને ધ્યાનમાં રાખી “કપાસની જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન” અંગેના ખેડૂત દિનની ઉજવણી અક્ષર ફાઈબર્સ ઈન્ડસ્ટ્રીઝ, ચામેઠા, તા. નસવાડી, જલ્લો છોટાઉદેપુર ખાતે તા. ૨૦-૦૧-૨૦૧૮ ને શનિવારનાં રોજ માનનીય કુલપતિશ્રી ડો. એન. સી. પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી. કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટ્ય તથા બાલિકાઓના સ્વાગત ગીતથી કર્યા બાદ શાબ્દિક સ્વાગત કરતા ડો. પી. કે. બોરડ, પ્રાધ્યાપક અને વડા કીટકશાસ્ત્રએ કપાસની સમસ્યા અંગે સર્વેને વાકેફ કર્યા.

કપાસનાં પાકની ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખી ચૂસીયા જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન અંગેની સરળતાથી ખેડૂતો સમજી શકે તે રીતે ડો. આર. કે. દુમર, સહ પ્રાધ્યાપકે ચર્ચા કરી અને તેને અનુરૂપ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ પણ આપવામાં આવ્યું. ડો. પી. કે. બોરડ, પ્રાધ્યાપક અને વડાએ અત્યારની જટીલ સમસ્યા કપાસની ગુલાબી ઈયળ અને તેનું વ્યવસ્થાપન અંગે ઉપસ્થિત સૌને જુદી જુદી તાંત્રિકતાનો ખ્યાલ આપ્યો. કપાસ અને અન્ય પાકમાં ખાતર અને પિયતનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની ટૂંકી માહિતી ડો. એમ. વી. પટેલ, પ્રાધ્યાપક અને વડા એગ્રોનોમી વિભાગ દ્વારા આપવામાં આવી. વિવિધ પાકોમાં નીંદણથી થતું નુકસાન અને તેનું નિરાકરણ અંગેની માહિતી ડો. બી. ડી. પટેલ, સંશોધન વૈજ્ઞાનિક (નીંદણ) દ્વારા પુરી પાડવામાં આવી. કપાસના પાકમાં આવતા રોગ નિયંત્રણ અંગેની માહિતી ડો. આર. એન. પાડે, પ્રાધ્યાપક અને વડા, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગે આપી. ડો. એચ. આર. પટેલ, સંશોધન નિયામકે વિષાણુંજન્ય રોગો અંગે જરૂરી પગલા સૂચવ્યા. કાર્યક્રમ દરમ્યાન ખેડૂતોના મૂંજવતા પ્રશ્નોનું ઉપસ્થિત વૈજ્ઞાનિકો દ્વારા સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવેલ. ડો. એન. આઈ. શાહ, પ્રાધ્યાપક અને વડા બાગયત વિભાગ દ્વારા બાગાયતી પાકોનો અવકાશ, ડો. આર. આર. આચાર્ય, સંશોધન વૈજ્ઞાનિક, શાકભાજીની વિવિધ જાતો અને તેના પ્રશ્નો અંગે છણાવટ કરી, જ્યારે ડો. પ્રવિણ લુણાગરીયા દ્વારા પશુઓમાં દુધ ઉત્પાદન વધારવાનાં ઉપાયો અંગે જણાવેલ.

આ કાર્યક્રમમાં ડો. કે. બી. કથિરીયા, સંશોધન નિયામક, ડો. એ. એ. પટેલ વિસ્તરણ શિક્ષણ નિયામક, શ્રી એમ. કે. કુરેશી સંયુક્ત ખેતી નિયામક અને ડો. કે. પી. પટેલ આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડો. કે. પી. પટેલ, આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષે જમીનમાં ખૂટતા વિવિધ સૂક્ષ્મતત્વો વિશે મહત્વની માહિતીને વણી લઈ આવા કાર્યક્રમોનો મહત્તમ લાભ લેવા હાંકલ કરેલ. શ્રી એમ. કે. કુરેશી, સંયુક્ત ખેતી નિયામકે સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં મળતી વિવિધ સહાયની અગત્યની માહિતી આપી. ડો. એ. એ. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકે કૃષિ ગોવિદ્યા, ખેડૂત પોર્ટલ અને કિસાન કોલ સેન્ટર વિશે વિસ્તૃત છણાવટ કરેલ અને કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લેવા ખેડૂતોને જણાવ્યું. ડો. કે. બી. કથિરીયા, સંશોધન નિયામકે કપાસની ગુલાબી ઈયળના વિવિધ રાજ્યોમાં નુકસાન અને નવી સુધારેલી જાતો વિશે માર્ગદર્શન આપ્યું. કપાસની ચૂસીયા જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન અંગેનું તૈયાર કરવામાં આવેલ ફોલ્ડરનું વિમોચન માન. કુલપતિશ્રી અને અન્ય મંચસ્થ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતાં ડો. એન. સી. પટેલ, માન. કુલપતિશ્રીએ મધ અને મશરૂમની ખેતી અંગે જાણકારી મેળવી તેમાં આગળ વધવા ખેડૂતોને અપીલ કરી તથા આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલતી વિવિધ તાલીમો લેવા ખેડૂતોને આમંત્રણ આપ્યું અને આ અંતરિયાળ વિસ્તારમાં વિશાળ ખેડૂત દિનનું આયોજન કરવા બદલ કીટકશાસ્ત્ર વિભાગના વડા ડો. પી. કે. બોરડ અને તેની ટીમને વિશેષ અભિનંદન પાઠવેલ. કાર્યક્રમને સફળ બનાવવામાં જીનીંગ મીલના માલિકશ્રી શાંતિભાઈ ઝાલાવાડીયા, અક્ષર ફાઈબર્સ ઈન્ડસ્ટ્રીઝનો ખુબજ સહયોગ પ્રાપ્ત થયેલ હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડો. આર. કે. દુમર, સહ પ્રધ્યાપક દ્વારા અને આભારદર્શન ડો. સી. બી. ધોબી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું દુરદર્શન દ્વારા રેકોર્ડીંગ પણ કરવામાં આવેલ.



ગામ ચામેઠા, તા. નસવાડી ખાતે યોજાયેલ કપાસ ઉપરનાં “ખેડૂત દિન”ની ઉજવણીની કેટલીક બોલતી તસ્વીરો તા. ૨૦-૦૧-૨૦૧૮